



જગતમાં મહેનત વગર કંઈ જ મળતું નથી, કંદાચ મળી પણ જાય તો તે ટકતું નથી
- એસ. ભટ્ટાચાર્ય

આપણું પોતાનું અખબાર

ગાંધીનગર સમાચાર



Gandhinagar વર્ષ : (૨૮) અંક નં. ૧

૧૨ માર્ચ, ૨૦૧૩, મંગળવાર; ફાગણ સુદ - ૧

પાનાં - ૮ કિંમત રૂ. ૧.૮૦

FORD CELEBRATIONS
જાણકારો! જાણકારો! સહ સહિયાર સાથે કોઈ કોઈની જેમ કુર્બાન મારો
Call: 9099977590

NEW FORD FIGO
રૂ. 3.98 લાખથી શરૂ
નવવર્ણ રૂ. 28000/- સુધી



મોટુર ભાઈઓ • ચિલ્ડ્રન • ગર્ભવતી સ્ત્રીઓ • સીમા સંપત્તીઓ • ડોક્ટર
• સર્જિકલ એસિસ્ટન્ટ • Defence Personnel (Service & Ex-servicemen) ખાસ કોડર
કરણ ફાઇનાન્સ • સોલો વ્યાજદાર • એક્સચેન્જ સુવિધા • હાથર ડિલિવરી

Cargo Ford પ્લોટ નં. ૧૩, પુર્વે ભાગ ડી.એ. સોલિસિટી, સુ.ડી.સી. રોડ, સેક્ટર-૨૭, મહેનગર
Call: 879-23261217 / 1517, 9099977590 • Email: an.gan@cargoford.com

ગાંધીનગર સમાચાર
આવો, મોં મીઠું કરીએ...

ગાંધીનગર સમાચારની વર્ષગાંઠ પ્રસંગે આપણે સૌ સાથે મળી એકબીજાનું મોં મીઠું કરાવીએ. સૌ વાચકો, વિતરકો, વિજ્ઞાપનદાતાઓ તથા સુભેચ્છકોને મોં મીઠું કરવા ગાંધીનગર સમાચાર આવકારે છે. સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ગાંધીનગર સમાચારના આંગણે આપનું સ્વાગત છે.

Finance રૂ. 2900/- ની ડી ડીસ

મોડલ - 1.5 Ton, 3 Star AC
મોડલ - 2013
ભાવ - સૌથી સસ્તો

સોથી સોછા ભાવની ગેરંટી

ચંદન ઇલેક્ટ્રોનિક્સ 155, ને-21, ૨૪૫વી કિલોમીટર પાસે, ગાંધીનગર.
ફોન: 23225121, 9227422288

શક્તિનું ઘોડાપુર

શ્રી નરનારાયણ આયુર્વેદિક ડ્રામ્સ
શ્રી નરનારાયણ આયુર્વેદિક ડ્રામ્સ
શ્રી નરનારાયણ આયુર્વેદિક ડ્રામ્સ

શુભારંભ

લક્ષ્મીચંદ્ર વિકેન્ડ બંગલો
અમદાવાદથી માત્ર 50 kmની અંતરે

આકર્ષક ડિસ્કાઉન્ટ
પ્રથમ ૫ બુકીંગ પર

રાધેવિલા
પ્રાંતિજ

- મહુડી ઘંટાકર્ણ મંદિર ફક્ત 12 km
- મલાડાળી મંદિર રોડ-સાપડ
- હાથવે રોડટય
- NA.NOC Clear
- Loan Paper ઉપલબ્ધ

સાઈટ: જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પીલુદ્રા - સાપડ રોડ, ને.હા.નં. - ૮, પ્રાંતિજ, જી. સાબરકાંઠા (M) 9825175165

HYUNDAI NEW THINKING. NEW POSSIBILITIES.

Magical March

આ માર્ચમાં મેગા મેજીકલ બચતનો આનંદ મેળવો.

Presenting the **Special Edition** **iTECH i10**



કુલ બચત **i20** ₹ 15,000* (પેટ્રોલ) ₹ 15,000* (ડીઝલ)

કુલ બચત **EON** ₹ 19,250* (પેટ્રોલ)

કુલ બચત **i10** ₹ 42,500*

નીચેના મોડલો પર પણ આકર્ષક બચત ઉપલબ્ધ

Accent કુલ બચત ₹ 30,700*	VERNA કુલ બચત ₹ 15,000* (પેટ્રોલ) કુલ બચત ₹ 15,000* (ડીઝલ)	SONATA સ્પે. ફાઈનાન્સ સ્કિમ 6.66% ROI*	SANTRO કુલ બચત ₹ 26,350*	ELANTRA કુલ બચત ₹ 25,000* (પેટ્રોલ) કુલ બચત ₹ 25,000* (ડીઝલ)	SANTA FE સ્પે. ફાઈનાન્સ સ્કિમ 5.55% ROI*
------------------------------------	-------------------------------------------------------------------------	-----------------------------------------------------	------------------------------------	---------------------------------------------------------------------------	-------------------------------------------------------

PUNJAB HYUNDAI

પ્લોટ નં. ૧૦૦૪ / એ, સેક્ટર-૨૮, જીઆઇડીસી, ડીએસપી ઓફિસ સામે, ગાંધીનગર. Call : 079-31907700

દ્વાન્ય : ૨-૫ ઉમિયા તીર્થ ઘીલે, ગાયત્રી મંદિરની પાસે, હાથવે રોડ, કલોલ-૩૮૨૭૨૧ (ઉ.ગુ.) Call : 9825012126

દ્વાન્ય : અતિથી હોટલ પાસે, આશીર્વાદ આંખની જનરલ હોસ્પિટલ, દહેગામ. Call : 9925042700

Best exchange value through ADVANTAGE

